

18. बिलस्य वाणी न कदापि मे श्रुता

[संस्कृतसाहित्यनी अनुपम कृति मनाता अने विश्वभरमां जाणीता अनेला पंचतंत्र नामना कथा-ग्रंथमांथी प्रस्तुत कथा लेवामां आवी छे. पंचतंत्रना कर्ता विष्णुशर्मा छे. तेमणे अमरशक्ति नामना राजना पुत्रोने मात्र छ मासना समयगाणामां राजनीतिमां निपुण बनाववा माटे आ ग्रंथ रच्यो હતો. आमां मित्रभेदः, मित्रप्राप्तिः, काकोलूकीयम्, लब्धप्रणाशः अने अपरीक्षितकारकम् એમ પાંચ તંત્ર (પ્રકરણ) આવેલાં છે. આ કારણે આ ગ્રંથનું નામ પંચતંત્ર છે.

દરેક તંત્રના પ્રારંભે પ્રથમ એક કથાની માંડણી કરાય છે અને પછી તેની પેટા કથાઓ તરીકે અનેક કથાઓ આવતી રહે છે. ગદ્ય અને પદ્ય એ બંને શૈલીમાં રચાયેલી નાની નાની સરસ પ્રાણીકથાઓની અદ્ભુત સંકલ્પના આ ગ્રંથમાં છે. દરેક કથામાં માણસનું બુદ્ધિચાતુર્ય વધે, તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. કથાની અંતર્ગત કોઈ એક વિષયના અનુકૂળ તેમજ પ્રતિકૂળ બંને પક્ષ સામે ધરીને કથાવસ્તુને આગળ વધારવામાં આવી છે. કથાકથનની આ વિશિષ્ટ શૈલીને કારણે મનોરંજનની સાથે સાથે જીવનમાં ઉપયોગી એવો અમૂલ્ય ઉપદેશ પણ વાચકને પ્રાપ્ત થતો રહે છે.

આવનારી આપત્તિની જાણ અને તે પછી તેમાંથી બચવાનો ઉપાય શીખવતી આ કથાનો અભ્યાસ કરતી વખતે અહીં વપરાયેલાં અવ્યયપદોનો પણ અભ્યાસ કરીશું.]

कस्मिंश्चित् वने खरनखरः नाम सिंहः प्रतिवसति स्म । सः कदाचित् इतस्ततः परिभ्रमन् क्षुधार्तः न किञ्चिदपि आहारं अलभत । ततः सूर्यास्तसमये एकां महतीं गुहां दृष्ट्वा सः अचिन्तयत् – “नूनम् एतस्यां गुहायां रात्रौ कोऽपि जीवः आगच्छति । अतः अत्रैव निगूढो भूत्वा तिष्ठामि” इति ।

एतस्मिन् अन्तरे गुहायाः स्वामी दधिपुच्छः नाम शृगालः समागच्छत् । स च यावत् पश्यति तावत् सिंहपदपद्धतिः गुहायां प्रविष्टा, न च बहिरागता अपश्यत् । शृगालः अचिन्तयत् – “अहो विनष्टोऽस्मि । नूनम् अस्मिन् बिले सिंहः अस्तीति तर्कयामि । तत् किं करवाणि ?” एवं विचिन्त्य दूरस्थः रवं कर्तुमारब्धः – “भो बिल ! भो बिल ! किम् न स्मरसि यन्मया त्वया सह समयः कृतोऽस्ति यत् यदाहं बाह्यतः प्रत्यागमिष्यामि तदा त्वं माम् आकारयिष्यसि ? यदि त्वं मां न आह्वयसि तर्हि अहं द्वितीयं बिलं यास्यामि इति ।”

अथ एतच्छ्रुत्वा सिंहः अचिन्तयत् – ‘नूनमेषा गुहा स्वामिनः सदा समाह्वानं करोति । परन्तु मद्द्रयात् न किञ्चित् वदति ।’ तदहम् अस्य आह्वानं करोमि । एवं सः बिले प्रविश्य मे भोज्यं भविष्यति । इत्थं विचार्य सिंहः



सहसा शृगालस्य आह्वानमकरोत् । सिंहस्य उच्चगर्जनस्य प्रतिध्वनिना सा गुहा उच्चैः शृगालम् आह्वयत् । अनेन अन्येऽपि पशवः भयभीताः अभवन् । शृगालोऽपि ततः दूरं पलायमानः इममपठत् -

अनागतं यः कुरुते स शोभते
स शोच्यते यो न करोत्यनागतम् ।
वनेऽत्र संस्थस्य समागता जरा
बिलस्य वाणी न कदापि मे श्रुता ॥

टिप्पणी

नाम : (पुंल्लिङ्ग) : (खरनखरः अे नाम छे.) **क्षुधार्तः** लूभथी पीडायेल, लूभ्यो, **जीवः** प्राणी, छव **निगूढः** संतायेल, छुपायेल (दधिपुच्छः अे शियाणनुं नाम छे.) **शृगालः** शियाण, **रवः** ध्वनि, अवाज, **समयः** शरत, नियम.

(स्त्रील्लिङ्ग) : **गुहा** गुफा, **सिंहपदपद्धतिः** सिंढनां पगलांनी छाप-निशानी **प्रतिध्वनिः** पडधो **जरा** वृद्धावस्था, धडपण.

(नपुंसकल्लिङ्ग) : **बिलम्** दर **भयम्** भय, डर.

सर्वनाम : **एतस्याम्** आमां (स्त्रील्लिङ्ग) **एतस्मिन्** आमां (पुंल्लिङ्ग) **अस्मिन्** आमां (पुंल्लिङ्ग) **मया** मारा थकी, मारा वडे, माराथी **त्वया** तारा थकी, तारा वडे, ताराथी **माम्** मने **एषा** आ (स्त्रील्लिङ्ग) **अस्य** आनुं **अनेन** आना थकी, आना द्वारा, आनाथी **अन्ये** बीजाओ (पुंल्लिङ्ग) **इमम्** आने (पुंल्लिङ्ग) **मे** मारुं (आ मम षष्ठी अेकवचननुं वैकल्पिक रूप छे. ते क्यारेय वाक्यनी शरुआतमां आवतुं नथी.)

विशेषण : **दूरस्थ** दूर रडेलुं **कृत** करेलुं **द्वितीय** बीजुं **अनागत** आव्युं न डोय तेवुं, आवनारुं.

अव्यय : **कस्मिंश्चित्** कोरुं अेकमां, कोरुं **किञ्चिदपि** कंरुं पण, थोडुं पण **अत्रैव** अरुं ज **बाह्यतः** अरुंनी अाजुथी, अरुंथी **यदा** ज्यारे **तदा** त्यारे **इत्थम्** आ रीते **सहसा** अथानक **उच्चैः** उंचेथी, मोटेथी.

समास : **क्षुधार्तः** (क्षुधया आर्तः, तृतीया तत्पुरुष) । **सूर्यास्तसमये** (सूर्यस्य अस्तः सूर्यास्तः । सूर्यास्तस्य समयः सूर्यास्तसमयः, तस्मिन् । षष्ठी तत्पुरुष) । **सिंहपदपद्धतिः** (सिंहस्य पदानि सिंहपदानि । सिंहपदानां पद्धतिः सिंहपदपद्धतिः । षष्ठी तत्पुरुष) **भयभीताः** (भयेन भीताः, तृतीया तत्पुरुष) **अनागतम्** (न आगतम् अनागतम्, नञ् तत्पु.)

कृदन्तपद : **दृष्ट्वा** (दृश् + त्वा) । **भूत्वा** (भू + त्वा) । **श्रुत्वा** (श्रु + त्वा) । **प्रविश्य** (प्र + विश् + त्वा > य) ।

क्रियापद : **प्रथम गण :** (परस्मैपद) **प्रति + वस्** (प्रतिवसति) वसवुं, रडेवुं **स्मृ** (स्मरति) स्मरण करवुं, याद करवुं **प्रति + आ + गम् - गच्छ** (प्रत्यागच्छति) पाछा वणवुं **आ + ह्वे - ह्वय** (आह्वयति) बोलाववुं **पठ्** (पठति) लणवुं, पाठ करवो, वांचवुं.

(आत्मनेपद) **शुभ्** (शोभते) शोभवुं.

दशम गण : (परस्मैपद) **तर्क्** (तर्कयति) अटकण करवी, कल्पना करवी, धारवुं.

विशेष

(1) शब्दार्थ : परिभ्रमन् रभडतो, भ्रमण करोतो, लटकतो क्षुधार्तः लूज्यो, लूजथी पीडतो निगूढो भूत्वा संताईने, छुपाईने तर्कयामि विचारुं छुं. समशुं छुं. किं करवाणि शुं करुं ? दूरस्थः दूर उलो रडेलो आकारयिष्यति आवकारीश. बोलावीश. भोज्यम् भावानुं भोजन आह्वानमकरोत् आवाहन करुं. उच्चगर्जनस्य मोटी गर्जनाना पलायमानः लागतो, नासी जतो कुरुते करे छे. शोच्यते शोकनुं-यितानुं पात्र बने छे. संस्थस्य रडेलाने, वसताने न कदापि मे श्रुता में क्यारेय सांभणी नथी.

(2) संधि : इतस्ततः (इतः ततः) । कोऽपि (कः अपि) । अत्रैव (अत्र एव) । निगूढो भूत्वा (निगूढः भूत्वा) । बहिरागता (बहिः आगता) । विनष्टोऽस्मि (विनष्टः अस्मि) । यन्मया (यत् मया) । कृतोऽस्ति (कृतः अस्ति) । यदाहम् (यदा अहम्) । एतच्छ्रुत्वा (एतत् श्रुत्वा) । अन्येऽपि (अन्ये अपि) । शृगालोऽपि (शृगालः अपि) । करोत्यनागतम् (करोति अनागतम्) । वनेऽत्र (वने अत्र) ।

स्वाध्याय

1. विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।

(1) कीदृशः सिंहः वने इतः ततः परिभ्रमणम् अकरोत् ।

(क) तृषार्तः (ख) क्षुधार्तः (ग) भयार्तः (घ) निगूढः

(2) शृगालस्य नाम किम् आसीत् ।

(क) खरनखरः (ख) मदोन्मत्तः (ग) दीर्घपुच्छः (घ) दधिपुच्छः

(3) शृगालस्य गुहायां कः प्रविष्टः ।

(क) शृगालः (ख) सिंहः (ग) गजः (घ) शशकः

2. एकवाक्येन संस्कृतभाषया उत्तरं लिखत ।

(1) सूर्यास्तसमये सिंहः किम् अपश्यत् ?

(2) शृगालः कस्य पदपद्धतिम् अपश्यत् ?

(3) शृगालस्य वचनं श्रुत्वा सिंहः किम् अकरोत् ?

(4) बिलस्य वाणी न कदापि मे श्रुता - इति वाक्यं कः वदति ?

3. घटना-क्रमानुसारं वाक्यानि लिखत ।

(1) शृगालः अपि ततः दूरं पलायमानः इमम् अपठत् ।

(2) क्षुधार्तः सिंहः किञ्चिदपि आहारं न अलभत ।

(3) इत्थं विचार्य सिंहः सहसा शृगालस्य आह्वानम् अकरोत् ।

(4) भो बिल ! भो बिल ! किं न स्मरसि ।

(5) अतः अत्रैव निगूढो भूत्वा तिष्ठामि ।

(6) यदि त्वं मां न आह्वयसि तर्हि अहं द्वितीयं बिलं यास्यामि ।

4. कृदन्तप्रकारं लिखत ।

- (1) दृष्ट्वा (2) भूत्वा (3) विचिन्त्य
- (4) कर्तुम् (5) प्रविश्य

5. स्म-प्रयोगेण क्रियापदानि परिवर्तयत ।

- (1) अचिन्तयत् (2) अगच्छत् (3) अपठत् (4) अवसत्

6. समासप्रकारं लिखत ।

- (1) सूर्यास्तः (2) पदपद्धतिः (3) भयभीताः (4) गर्जनप्रतिध्वनिः

7. मातृभाषया उत्तराणि लिखत ।

- (1) सांजना समये गुफाने जेठने सिंहे शुं विचार्युं ?
- (2) गुफाना स्वामी शियाणे गुफा आगण पगलांनी निशानी जेठने शुं विचार्युं ?
- (3) गुफाथी दूर रडीने शियाणे गुफाने कर्ण शरत याद करावी ?
- (4) आ वार्ता परथी शो बोध मणे छे ?
- (5) शियाणे जतां-जतां शुं कहुं ?

8. मातृभाषायाम् अनुवादं लिखत ।

- (1) अतः अत्रैव निगूढो भूत्वा तिष्ठामि ।
- (2) नूनम् अस्मिन् बिले सिंहः इति तर्कयामि ।
- (3) यदि त्वं मां न आह्वयसि तर्हि अहं द्वितीयं बिलं यास्यामि ।
- (4) एवं सः बिले प्रविश्य मे भोज्यं भविष्यति ।
- (5) अनेन अन्ये अपि पशवः भयभीताः अभवन् ।
- (6) बिलस्य वाणी न कदापि मे श्रुता ।

9. अव्ययपदानाम् अर्थं लिखत ।

- (1) यदा (2) तथा (3) कुत्र
- (4) इतः (5) सर्वदा

प्रवृत्ति

- कोठि ओक प्राणीकथाने तमारा शब्दोमां लपो.